



17 સપ્ટેમ્બર, 2021

તમારો NHS ક્રમાંક: [NHS NUMBER]

પ્રિય [Patient],

### COVID-19 વિશે તમારા માટે મહત્વપૂર્ણ માહિતી

અમે તમને લખી રહ્યા છીએ કારણ કે તમને અગાઉ COVID-19 માટે તબીબી રીતે અત્યંત સંવેદનશીલ ઓળખવામાં આવ્યા હતા. જેનો અર્થ એ છે કે જો તમે વાયરસથી સંક્રમિત થાવ છો તો તેમને ગંભીર બીમારીના ઉચ્ચ જોખમમાં ગણવામાં આવે છે. ભૂતકાળમાં તમારે શિલ્ડ ની સલાહ આપવામાં આવી હશે.

માર્ચ મહિનામાં સરકારે તમને પત્ર લખીને જણાવ્યું હતું કે 1 એપ્રિલ 2021 થી તમારો શિલ્ડિંગમાં રહેવાનો સમયગાળો રોકવામાં આવે છે. 19 જુલાઈ 2021 થી તમને COVID-19 સંક્રમણ થવાની શક્યતા ઘટાડવા માટે તમને વધારાની સાવચેતીઓ વિકસાવવામાં આવે છે. અન્ય બધાની જેમ જ માર્ગદર્શિકાનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.

હવે જ્યારે તમામ પુખ્ત વસ્તીને રસીકરણ માટે ઓફર કરવામાં આવી રહી છે, જેમાં અગાઉ તબીબી રીતે અત્યંત સંવેદનશીલ તરીકે ઓળખવા લોકોનો પણ સમાવેશ થાય છે, અને અન્ય સારવાર અને સંભાળની રીતો ઉપલબ્ધ છે, ત્યાં હું તમને છું કે શિલ્ડિંગ કાર્યક્રમ સમાપ્ત કરવાનો આ યોગ્ય સમય છે. આનો અર્થ એ છે કે વર્તમાન પરિસ્થિતિને જોતા તમને ભવિષ્યમાં શિલ્ડ માટેની સલાહ આપવામાં આવશે નહીં અને અમે તમને અનુસરવા માટે ચોક્કસ રાષ્ટ્રીય માર્ગદર્શન આપીશું નહીં.

તમારે તાજેતરના સત્તામાં તમારા નિષ્ણાત દ્વારા આપવામાં આવેલી કોઈપણ સ્થિતિ માટેની વિશેષ સલાહ ઉપરાંત, અન્ય બધાની જેમ સમાન સામાન્ય માર્ગદર્શનનું પાલન કરવાનું ચાલુ રાખવું જોઈએ, જે [www.gov.uk/coronavirus](http://www.gov.uk/coronavirus), પર મળી શકે છે. તમારા સ્વાસ્થ્યની સ્થિતિ ધરાવતા વ્યક્તિ તરીકે તમારે પણ તમારી જાતને અને અન્ય લોકોને સુરક્ષિત રાખવા માટે કરી શકો તેવી વધારાની બાબતો વિશે વિચારવું જોઈએ. તેમાં આ શામેલ હોઈ શકે છે:

- તમે અને તમે જેમની મુલાકાત કરો છો તેમને રસી આપવામાં આવી છે કે કેમ તે ધ્યાનમાં લેતા-તમારે અન્ય લોકો સાથે નજીકના સંપર્કમાં આવતાં પહેલા દરેક વ્યક્તિની COVID-19 રસીના બીજા ડોઝ પછી 14 દિવસ સુધી રાહ જોવી જોઈશે
- જો તમારા અને તમારા મિત્રો માટે યોગ્ય લાગે તો સામાજિક અંતરનો અભ્યાસ કરવાનું ચાલુ રાખો



- તમારી મુલાકાત લેતા પહેલા મિત્રો અને પરિવારને ઝડપી લેટરલ ફ્લો એન્ટિજેન ટેસ્ટ લેવા માટે કહેવું જોઈએ
- ઘરની મુલાકાત લેતા વ્યક્તિઓને ચહેરો ઢાંકવાનું કહેવું જોઈએ
- ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવું જોઈએ

રોગચાળાના શરૂઆતના દિવસોમાં, આપણી પાસે COVID-19 ના ખતરા વિશે સંપૂર્ણ જ્ઞાન વહેતું, અને તબીબી રીતે અત્યંત સંવેદનશીલ માનવામાં આવતા લોકોને વાયરસથી પોતાને બચાવવા માટે શિલ્ડ કરવાની સલાહ આપવાનો મુશ્કેલ નિર્ણય લેવામાં આવ્યો હતો. તે સમયે તે યોગ્ય નિર્ણય હતો અને જ્યારે આપણે COVID-19 વિશે વધુ શીખ્યા ત્યારે સૌથી સંવેદનશીલ લોકોને સમાપ્ત રાખવામાં મદદ કરી હતી.

હું જાણું છું કે શિલ્ડિંગની સલાહ એ પ્રતિબંધિત છે અને તે કદાચ માનસિક અને શારીરિક સુખાકારી બંનેને અસર કરી શકે છે. તેથી મહત્વનું છે કે આપણે સંવેદનશીલ લોકોને બચાવવા અને દરેકને સામાન્ય જીવનમાં પાછા ફરવામાં મદદ કરવા વચ્ચે સંતુલન જાળવીએ.

જો કે કેસોમાં વધારો થયો છે, પરંતુ લોકો ગંભીર રીતે બીમાર થઈ રહ્યા નથી અને હોસ્પિટલમાં જવા અથવા મૃત્યુમાં તેટલો વધારો થયો નથી. તેનું કારણ એ છે કે મોટે ભાગે રસીકરણ કાર્યક્રમ સફળ રહ્યો છે. રસી લેવી એ તમારી અને અન્ય લોકોની સુરક્ષા કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. લોકોને COVID-19 થી ગંભીર રીતે બીમાર થવાથી અટકાવવા માટે રસીઓ ખૂબ અસરકારક છે, તેથી હું તમને રસીના ભલામણ કરેલા તમામ ડોઝ મેળવવા માટે ભારપૂર્વક પ્રોત્સાહિત કરું છું.

શિલ્ડિંગ સલાહ અંગેના તમામ સંકારી નિર્ણયો વૈજ્ઞાનિક પુરાવાઓ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને આ સલાહ અદ્યતન રાખવામાં આવે છે. હવે જ્યારે ખૂબ જ બીમાર થવાનું જોખમ ઓછું થયું છે, ત્યારે હું માનું છું કે શિલ્ડિંગ કાર્યક્રમ સમાપ્ત કરવાનો સમય છે અને અંતર્ગત આરોગ્યની સ્થિતિ ધરાવતા લોકોને તેમની સામાન્ય વ્યક્તિગત સંભાળ પદ્ધતિઓ પર ફરીથી પાછા ફરવાની ભલામણ કરીએ છીએ.

## COVID-19 રસીઓ

જો કે મોટાભાગના લોકો રસી દ્વારા સારી રીતે સુરક્ષિત રહેશે, તેમ છતાં કોઈ પણ રસી 100% અસરકારક નથી. ખાસ કરીને, જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે તેઓ અન્ય લોકોની જેમ COVID-19 રસીઓને પણ પ્રતિસાદ આપી શકતા નથી. એટલા માટે રસીકરણ અને રોગપ્રતિરક્ષા સંયુક્ત સમિતિ (JCVI) એ 1 સપ્ટેમ્બર ના રોજ સલાહ આપી હતી કે 12 વર્ષથી વધુ ઉંમરના લોકો જેઓની રોગપ્રતિકારક શક્તિ તેમના પ્રથમ કે બીજા ડોઝના સમયે અથવા તેની આસપાસ ગંભીર રીતે ઓછી હતી, તેમના પ્રાથમિક રોગપ્રતિકારક કોર્સના ભાગરૂપે COVID-19 સામે સુરક્ષિત રહેવાની



Department  
of Health &  
Social Care

તેમની તકોમાં વધારો કરવા માટે તેમને રસીનો ત્રીજો ડોઝ આપવો જોઈએ. જો તમારી કોઈ એવી સ્થિતિ હોય અથવા તમે તમારી રોગપ્રતિકારક શક્તિને અસર કરતી દવાઓ લઈ રહ્યા હો તો આ સલાહ તમને લાગુ પડી શકે છે પરંતુ આ પત્ર પ્રાપ્ત કરનાર દરેક વ્યક્તિ ત્રીજા ડોઝ માટે પાત્ર રહેશે નહીં. તે કોને લાગુ પડે છે તેની વધુ વિગત અહીં મળી શકે છે: [રસીકરણ અને રોગપ્રતિરક્ષા સંયુક્ત સમિતિ \(JCVI\) ત્રીજા પ્રાથમિક ડોઝ રસીકરણ અંગેની સલાહ - GOV.UK \(www.gov.uk\)](#).

તમામ COVID-19 રસીઓ અમુક રક્ષણ આપે છે જેથી જો તમને એવી કોઈ સ્થિતિ હોય અથવા તમે રોગપ્રતિકારક શક્તિને અસર કરતી દવાઓ લેતા હોવ તો પણ તમારે રસી લેવી જોઈએ. રસી કાર્યક્રમ તે બધા માટે ખુલ્લો અને ઉપલબ્ધ રહેશે જેઓ તેને પાત્ર છે. જો તમે કોઈ પણ કારણોસર રસી લીધી ન હોય, અથવા જો તમારી રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, તો તમારે તમારી કાતને અને અન્ય લોકોને સુરક્ષિત રાખવામાં મદદ કરવા માટે આ પત્રની શરૂઆતમાં સૂચિબદ્ધ સાવચેતીઓનું પાલન કરવા માટે ભારપૂર્વક વિચાર કરવો જોઈએ.

તે ઉપરાંત, JCVI એ રસી બૂસ્ટર કાર્યક્રમ અંગે સલાહ પ્રકાશિત કરી છે જે અહીં જોઈ શકાય છે: [2021 થી 2022 ની શીત ઋતુ માટે COVID-19 બૂસ્ટર રસી કાર્યક્રમ સંબંધિત JCVI નું નિવેદન - GOV.UK \(www.gov.uk\)](#). તે ભલામણ કરવામાં આવી છે કે "જે વ્યક્તિએ COVID-19 રસીકરણ કાર્યક્રમ (પ્રાથમિકતા જૂથો 1 થી 9 વર્ષ) ના પ્રથમ તબક્કામાં રસીકરણ મેળવ્યું હોય તેમને ત્રીજા ડોઝની COVID-19 બૂસ્ટર રસી આપવી જોઈએ. આમાં આ સમાવેલ છે:

- વૃદ્ધ પુખ્ત વયના માટે રહેણાંક સંભાળ મારામાં રહેતા લોકો
- 50 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ પુખ્ત
- અગ્રણી આરોગ્ય અને આર્થિક સંભાળ કાર્યકરો
- 16 થી 49 વર્ષની વયના તમામ લોકો જે અંતર્ગત આરોગ્યની સ્થિતિ ધરાવે છે જે તેમને ગંભીર COVID-19 ના ઉચ્ચ જોખમમાં મૂકે છે (ગ્રીન બુકમાં દર્શાવ્યા મુજબ: [COVID-19: ગ્રીન બુક, પ્રકરણ 4 GOV.UK \(www.gov.uk\)](#)), અને પુખ્ત લોકોની સંભાળ રાખનારાઓ
- નબળા રોગપ્રતિકારક શક્તિ ધરાવતી વ્યક્તિઓના પુખ્ત કૌટુંબિક સંપર્કો (16 વર્ષ કે તેથી વધુ ઉંમરના)"

જો તમારા માટે ભલામણ કરવામાં આવે છે તો તમારા બીજા ડોઝના ઓછામાં ઓછા 6 મહિના પછી તમને NHS દ્વારા તમારી રસી બુક કરવા માટે આમંત્રિત કરવામાં આવશે.

હું સમજું છું કે તમને ચિંતા હોઈ શકે છે, અને દરેક પોતાના જોખમને અલગ રીતે અનુભવે છે, ખાસ કરીને જ્યો રસી દ્વારા ઓછી સારી રીતે સુરક્ષિત હોય.



## Department of Health & Social Care

જો તમારી રોગપ્રતિકારક શક્તિ ઓછી છે અને તમારા માટે આનો અર્થ શું છે તે અંગે કોઈ ચિંતા હોય, તો કૃપા કરીને તમારી આગામી નિયમિત એપોઇન્ટમેન્ટ દરમિયાન તમારા નિષ્ણાત સાથે આ અંગે વાત કરો. તેઓ તમને ચેપનું જોખમ વધુ ઘટાડવા માટે લઈ શકાય તેવા કોઈપણ વધારાના પગલાંઓ માટે તમને સમર્થન અને માર્ગદર્શન આપી શકે છે. તમારા GP તમને શિલ્ડિંગ મુદ્દાઓ માટે સલાહ આપી શકે તેવી શક્યતા નથી કારણ કે આ માટે નિષ્ણાત જ્ઞાનની જરૂર હોય છે, તેથી હું તેમને શિલ્ડિંગ સૂચિ વિશેના પ્રશ્નો માટે સંપર્ક ન કરવાનું સૂચન કરું છું. સામાન્ય તબીબી સમસ્યાઓ માટે GP હજુ પણ ખુલ્લા છે.

જો તમને હજુ સુધી તમારા પ્રથમ કે બીજા ડોઝની રસી આપવામાં આવી નથી તો હું તમને તે લેવા માટે વિનંતી કરીશ, અને જો તમે પાત્ર હોવ તો, જ્યારે તમારો વારો આવે ત્યારે પોસ્ટકોડની ઓફર સ્વીકાર કરો, જેથી તમને સ્વસ્થ રહેવામાં મદદ મળે.

### અન્ય સારવારો

અમે અપેક્ષા રાખીએ છીએ કે આગામી મહિનાઓમાં COVID-19 માટે નવી સારવાર ઉપલબ્ધ થશે. જ્યારે એવું થશે, ત્યારે અમે સલાહ આપીશું કે કયા દર્દીઓને લાભ થઈ શકે છે.

એ ખરેખર મહત્વનું છે કે જો તમે COVID-19 ના લક્ષણો હોવાને કારણે પરીક્ષણ કરો છો, તો તમે તમારો NHS નંબર અને પોસ્ટકોડ સરકારી વેબસાઇટમાં ચોક્કસપણે દાખલ કરો (જે અહીં જોઈ શકાય છે)

<https://test-for-coronavirus.service.nhs.uk/register-home-test>) જેથી તમારા પરીક્ષણનું પરિણામ તમારા આરોગ્ય રેકૉર્ડ સાથે જોડ કરી શકાય. આમ કરવાનો અર્થ એ છે કે જો તમે સારવારથી લાભ મેળવી શકો તો NHS તમારો સંપર્ક કરી શકે છે.

### NHS સેવાઓનો ઉપયોગ કરવા

તે મહત્વનું છે કે તમારે સુરક્ષિતપણે અને સારી રીતે રહેવા માટે તમને જરૂરી સંભાળ અને સહાય મેળવવાનું આપી રાખી. તમારી હાલની સ્વાસ્થ્ય સ્થિતિઓ અને કોઈપણ નવી સ્વાસ્થ્ય ચિંતાઓ માટે તમારે NHS અને અન્ય આરોગ્ય પ્રદાતાઓ પાસેથી તબીબી સહાય મેળવવાનું ચાલુ રાખવું જોઈએ. ઓનલાઇન પરામર્શ દ્વારા તમારા આરોગ્ય વ્યવસાયીનો સંપર્ક કરવો અથવા પુનરાવર્તિત પ્રિસ્ક્રિપ્શનોનો ઓર્ડર આપવા સહિત, તમે ઘરેથી NHS સેવાઓની શ્રેણીની પહોંચ પ્રાપ્ત કરી શકો છો. વધુ જાણકારી માટે, મુલાકાત લો [www.nhs.uk/health-at-home](http://www.nhs.uk/health-at-home), અથવા NHS એપ ડાઉનલોડ કરો. જો તમને તાત્કાલિક તબીબી જરૂરિયાત હોય, તો તમે [NHS 111 ઓનલાઇન](http://www.nhs.uk/111), સમર્થન અને સ્થાનિક સેવાઓ એક્સેસ કરી શકો છો, અથવા જો તમે ઇન્ટરનેટનો ઉપયોગ ન કરી શકો તો NHS 111 ને નિશ્ચલ કોલ કરી શકો છો. તબીબી કટોકટી માટે, 999 ડાયલ કરો.

### માનસિક સ્વાસ્થ્ય સમર્થન



Department  
of Health &  
Social Care

તમારા માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ ખરેખર મહત્વનું છે. તમે તમારી સુખાકારીને સમર્થન આપવા અને તમારા માનસિક સ્વાસ્થ્યને સંચાલિત કરવા માટે લઈ શકો તેવી સલાહ અને વ્યવહારુ પગલાં માટે [Every Mind Matters \(એવરી માઇન્ડ મેટર્સ\)](http://www.nhs.uk/every-mind-matters) વેબસાઇટ ([www.nhs.uk/every-mind-matters](http://www.nhs.uk/every-mind-matters)) એક્સેસ કરી શકો છો. તમે [હબ ઓફ હોપ](http://www.hubofhope.co.uk) ([www.hubofhope.co.uk](http://www.hubofhope.co.uk)) પણ એક્સેસ કરી શકો છો જે તમારો પોસ્ટકોડ દાખલ કરીને તમારા વિસ્તારમાં ઉપલબ્ધ સમર્થન વિશે જણાવે છે.

જો તમે અથવા તમે જેની સંભાળ લો છો તે માનસિક સ્વાસ્થ્ય સંકટનો સામનો કરી રહ્યાં છો, તો અમે તમને તરત જ એક સ્થાનિક સ્વાસ્થ્ય વ્યવસાયીનો સંપર્ક કરવાની વિનંતી કરીએ છીએ. જો તમારી પાસે સ્વાસ્થ્ય વ્યવસાયી નથી જેની સાથે તમે નિયમિત રીતે તમારા માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરો છો, તો દેશના પ્રત્યેક ભાગમાં નિશુલ્ક NHS 24/7 કટોકટી હોટલાઇન ઉપલબ્ધ છે. તમે તમારી સ્થાનિક સેવા અહીંથી: <https://www.nhs.uk/service-search/mental-health/find-an-urgent-mental-health-helpline> અથવા 'NHS કાઇસિસ લાઇન્સ' પર શોધી શકો છો.

તમારી સ્થાનિક કાઉન્સિલ સમર્થન નેટવર્ક અથવા હબ પણ પલાળી શકે છે, અને તમારા વિસ્તારમાં એવી ચેરિટી સંસ્થાઓ હોઈ શકે છે જે તમને જરૂર હોય તેવી વધારાની મદદ પૂરી પાડી શકે. તમારી સ્થાનિક કાઉન્સિલની વેબસાઇટ પર આ વિશે વધુ માહિતી મળશે.

જેમ જેમ પ્રતિબંધો હળવા થાય છે તેમ, ઘણા લોકો હજુ પણ એકલતા અને અલગતા અનુભવી શકે છે તેથી જો તમને અથવા તમારા કોઈ પરિચિત ને એકલતાનો અનુભવ થાય તો શરૂઆતમાં પગલાં લેવા વધુ મહત્વનું રહેશે. સલાહ અને સહાય મેળવવા માટે ક્લબ કરોને <https://letstalkloneliness.co.uk/> ની મુલાકાત લો.

ખરીદી, દવા અથવા અન્ય આગવું પુરવઠો એકત્રિત કરવા અને તબીબી એપોઇન્ટમેન્ટમાં પરિવહન જેવી બાબતોમાં મદદ માટે NHS સ્વયંસેવક પ્રતિસાદકર્તાઓ પણ ઉપલબ્ધ છે. તેઓ નિયમિત, મૈત્રીપૂર્ણ ફોન કોલ સેવાઓ પણ આપી શકે છે. વધુ માહિતી [www.nhsvolunteerresponders.org.uk](http://www.nhsvolunteerresponders.org.uk), પર ઉપલબ્ધ છે, અથવા તમે સવારે 8 થી રાત્રે 8 વાગ્યા વચ્ચે 0808 196 3646 પર કોલ કરી શકો છો.

### અન્ય સમર્થન

હું જાણું છું કે COVID-19 રોગચાળો તમારા જીવનના ઘણા પાસાઓ પર નોંધપાત્ર અસર કરી શકે છે, ખાસ કરીને જ્યારે તમને શિલ્ડની સલાહ આપવામાં આવી હોય. જો તમે આર્થિક રીતે અથવા કામ પર પાછા ફરવા માટે સંઘર્ષ કરી રહ્યા છો, તો એવી ઘણી સેવાઓની શ્રેણી છે જે યોગ્યતાના આધારે ઉપયોગી થઈ શકે છે.

એક્સેસ ટુ વર્ક એવા લોકોને વ્યવહારુ સમર્થન આપી શકે છે જેઓ સ્વાસ્થ્યની એવી સ્થિતિ ધરાવે છે જે તેમના કામ કરવાની રીતને પ્રભાવિત કરે છે. આ યોજના નોકરીની ગેરહાજરી અથવા શિલ્ડિંગના સમયગાળા પછી કામ પર પાછા ફરતા લોકો માટે માનસિક આરોગ્ય સમર્થન અને જે લોકો હવે જાહેર પરિવહન



Department  
of Health &  
Social Care

દ્વારા સલામત રીતે મુસાફરી કરી શકશે નહીં તેમના માટે મુસાફરી-થી-કામ પર જવા માટેના સમર્થન સહિત સહાય પ્રદાન કરી શકે છે. વધુ માહિતી માટે, કૃપા કરીને અહીં મુલાકાત લો: [www.gov.uk/access-to-work](http://www.gov.uk/access-to-work).

જો તમે આર્થિક રીતે સંઘર્ષ કરી રહ્યા છો, તો તમે યુનિવર્સલ ક્રેડિટ અથવા એમ્પ્લોયમેન્ટ સપોર્ટ ભથ્થા માટે અરજી કરવા માટે પણ પાત્ર હોઈ શકો છો. લાભો વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને અહીં મુલાકાત લો: [www.gov.uk/financial-help-disabled](http://www.gov.uk/financial-help-disabled).

સુપરમાર્કેટ 21<sup>મી</sup> જૂન ના રોજ સરકારની સલાહ પર તબીબી રીતે અત્યંત સંવેદનશીલ વીડીને સુપરમાર્કેટ સ્લોટમાં પ્રાધાન્યતા આપવાનું બંધ કર્યું છે. જો કે, સુપરમાર્કેટ સ્લોટમાં પ્રાધાન્યતા એક્સેસ માટે વિવિધ સુપરમાર્કેટ્સની પોતાની અલગ નીતિઓ હોઈ શકે છે.

જો તમને સહાયની જરૂર હોય તો તમારી સ્થાનિક કાઉન્સિલ પણ મદદ કરી શકે છે. તમે તમારી સ્થાનિક કાઉન્સિલ અહીં શોધી શકો છો: [www.gov.uk/find-local-council](http://www.gov.uk/find-local-council).

તમે ACAS દ્વારા પ્રકાશિત અને હાઇબ્રિડ વર્કિંગ પર ફ્લેક્સિબલ વર્કિંગ પાર્ક-ફોર્સ સાથે જોડાણમાં વિકસિત સલાહ પણ અહીં મેળવી શકો છો: [www.acas.org.uk/hybrid-working](http://www.acas.org.uk/hybrid-working).

## તમારો ડેટા

શિલ્ડિંગના સમયગાળા દરમિયાન, તમે સમર્થન મેળવવા માટે તમારી વિગતો નેશનલ શિલ્ડિંગ સર્વિસ સિસ્ટમ) સાથે નોંધણી કરાવી હશે, જે ક્વે સમાપ્ત થઈ ગઈ છે. આ સેવા માટે ગોપનીયતા સૂચનાને હવે શિલ્ડિંગ પ્રોગ્રામ સમાપ્ત કરવાના નિર્ણય અનુરૂપ અપડેટ કરવામાં આવી છે. જો તમે તમારા વ્યક્તિગત ડેટા વિશે વધુ જાણવા માંગતા હો, તો કૃપા કરીને અપડેટ કરવામાં આવેલી ગોપનીયતા સૂચના અહીં જુઓ: [www.gov.uk/coronavirus-shielding-support](http://www.gov.uk/coronavirus-shielding-support).

NHS ડિજિટલ તમારા શિલ્ડેડ ડેટા ગવર્નન્સ જરૂરિયાતો અનુસાર દર્દીઓના તબીબી રેકોર્ડ અને તેમની સારવાર જાહેરી રાખે છે. NHS ડિજિટલ તમારા વ્યક્તિગત ડેટાનો ઉપયોગ કેવી રીતે કરે છે તે વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને તેમની પારદર્શિતા સૂચના અહીં જુઓ: [digital.nhs.uk/coronavirus/shielded-patient-list/shielded-patient-list-transparency-notice](http://digital.nhs.uk/coronavirus/shielded-patient-list/shielded-patient-list-transparency-notice).

મને ખબર છે કે રોગચાળાનો સમય દરેક માટે મુશ્કેલ રહ્યો છે અને જો તમને વધારાની સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે તો તેમના માટે તે ખાસ કરીને ખૂબ જ મુશ્કેલ સમય રહ્યો છે. તમને તબીબી રીતે અત્યંત સંવેદનશીલ જુથમાં સામેલ કરવાનો નિર્ણય તે સમયે અમારી પાસેની માહિતીના આધારે લેવામાં આવ્યો હતો, જેથી તેમને સુરક્ષિત રાખી શકાય. તમારી જાતને અને અન્ય લોકોને સુરક્ષિત રાખવાના તમારા પ્રયત્નો બદલ તમારો આભાર.

આપનો સ્નેહાધીન,



Department  
of Health &  
Social Care

S. Javid.

RT HON SAJID JAVID MP (મહાઆદરણીય સાજિદ જાવિદ એમપી)

આ પત્ર GOV.UK પર, સરળ રીતે વાંચવા સહિત વિવિધ ભાષાઓ અને સ્વરૂપોમાં ઉપલબ્ધ થશે. ઓડિઓ, બ્રેઇલ, મોટી પ્રિન્ટ માટે 0303 1239999 પર RNIB ને કોલ કરો

Withdrawn April 2022